

July 11, 2025

To,
BSE Limited
Listing Department,
P. J. Towers, Dalal Street,
Mumbai – 400 001
(Scrip Code: 500365)

Dear Sir/Madam,

Subject: Newspaper publication regarding opening of special window for relodgement of transfer requests of physical shares of Welspun Specialty Solutions Limited.

Pursuant to regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of newspaper publications with respect to opening of special window for re-lodgement of transfer requests of physical shares in accordance with SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 02, 2025, published on July 11, 2025 in Financial Express (English) and Financial Express (Gujarati).

Please take the same on record.

Thanking you,

Yours faithfully, For **Welspun Specialty Solutions Limited** 

Suhas Pawar Company Secretary & Compliance Officer ACS-36560

Encl.: as above.

### **Welspun Specialty Solutions Limited**

Welspun House, 5th Floor, Kamala City, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai 400 013, India. T: +91 22 6613 6000 / 2490 8000 | F: +91 22 2490 8020 E-mail: companysecretary\_wssl@welspun.com | Website: www.welspunspecialty.com

Registered Address & Works: Plot No. 1, GIDC Industrial Estate, Valia Road, Dist. Bharuch, Jhagadia, Gujarat - 393110. India

Corporate Identity Number: L27100GJ1980PLC020358

## FINANCIAL EXPRESS

HERO HOUSING FINANCE LIMITED 011 49267000, Toll Free Number: 1800 212 8800, Email: customer.care@herohfl.com Website: www.herohousingfinance.com | CIN: U65192DL2016PLC30148 Contact Address: Office No 49, Second floor, Girnar Khushboo Plaza, Commercial Plot no 209, Vapi, Dist - Valsad, Gujarat - 396195.

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY) (As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002) Whereas, the undersigned being the Authorized Officer of the Hero Housing Finance Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act; 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notices as mentioned below calling upon the Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of the said notice. The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, in particular and the public, in general, that the undersigned has taken possession of the property described

herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule The borrower, in particular, and the public in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Hero Housing Finance Limited, for an amount referred to below along with interest thereon and penal interest, charges, costs

etc. from date mentioned below The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect

of time available, to	redeem the secured assets.		
Loan Account No.	Name of Obligor(s)/ Legal Heir(s)/Legal Representative(s)	Date of Demand Notice/ Amount as per Demand Notice	Date of Possession (Constructive/ Physical)
HHFVAPHOU220 00024928 & HHFVAPIPL2200 0024930	Alka Manish Khairnar, Deepak Chhabulal Jagtap, Chhabulal Ramchandra Jagtap, Kaipna Chhbulal Jagtap	22/04/2025 Rs. 1833016/- as on 09/04/2025	08.07.2025 (Symbolic)

Description of Secured Assets/Immovable Properties: All that piece and parcels of the immovable property being Flat No. 403, on 4th Floor admeasuring 37.31 Sq. Mtr. Carpet area and balcony admeasuring about 3.30 Sq. Mtr. Total admeasuring 40.61 Sq. Mtr., along with undivided land 10.00 sq. Mts. building known as "SURYA DARSHAN HEIGHTS", Construction on N.A. land bearing Khata no 4628, Revenue Survey No. 28/4/Paikee 2, (new Survey No. 1592), admeasuring 2125.00 Sq. Mtr., within the limits of Vapi Nagarpalika Taluka: Vapi, and District: Valsad in the State of Guirat, With Common Amenities Written in Title Document, Property Bounded By: North : By Shivhari Building, South: By Flat No 402, East: By Passage, West: By Building compound wall Date: 11.07.2025 Place: - Vapi Sdl- Authorised Officer, For Hero Housing Finance Limited

Welspun specialty solutions

# **WELSPUN SPECIALTY SOLUTIONS LIMITED**

CIN: L27100GJ1980PLC020358 Registered Office: Plot No 1, G I D C Industrial Estate, Valia Road, Jhagadia, Dist. Bharuch Gujarat- 393110.

Corporate Office: 5th Floor, Welspun House, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai - 400013. Email: companysecretary\_wssl@welspun.com Website: www.welspunspecialty.com **Tel:** +91 -22-66136000 **Fax:** +91-22-2490 8020

**Special Window for Re-lodgement of Transfer Requests** of Physical Shares of Welspun Specialty Solutions Limited Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025, all Shareholders of the Company are hereby informed that a Special Window is open for a period of six months, from July 7, 2025 till January 6, 2026 for re-lodgement of transfer requests of physical shares which were lodged prior to the deadline of April 1, 2019 and rejected/ returned/ not attended to due to deficiency in the documents/process/ or otherwise. Investors who have missed earlier deadline of March 31, 2021 (the cut-off date for re-lodgement of transfer deeds) can take this opportunity by furnishing the necessary documents to the Company's Registrar & Transfer Agent M/s. Bigshare Services Private Limited, Office No S6-2 6th Floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East), Mumbai - 400 093, Tel No.: 022 6263 8200 Email ID: Investor@bigshareonline.com

> For Welspun Specialty Solutions Limited Sd/ **Suhas Pawar**

> > **Company Secretary**

A-36560

Date: July 10, 2025 Place: Mumbai

## POSSESSION NOTICE (for immovable property)

## Whereas,

date of receipt of the said Notice.

The undersigned being the Authorized Officer of SAMMAAN CAPITAL LIMITED (CIN:L65922DL2005PLC136029) (formerly known as INDIABULLS HOUSING FINANCE LIMITED) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 25.09.2021 calling upon the Borrower(s) KANSAGARA SHARDABEN G, KANSAGARA HITESHKUMAR GIRDHARLAL, TUSHAR GIRDHAR KANSAGARA KANSAGARA DARSHANABEN TUSHARBHAI, KANSAGARA ALPABEN HITESHKUMAR, KANSAGARA HITESHKUMAR GIRDHARLAL and KANSAGARA GIRDHARLAL MOHANLAL to repay the amount mentioned in the Notice being Rs. 27,42,074.39 (Rupees Twenty Seven Lakhs Forty Two Thousand Seventy Four and Paise Thirty Nine Only) against Loan Account No. HLAPRAJ00238801 as on 26.06.2021 and interest thereon within 60 days from the

The Borrower(s) having failed to repay the amount, Notice is hereby given to the Borrower(s) and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 06.07,2025.

The Borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of SAMMAAN CAPITAL LIMITED (formerly known as INDIABULLS HOUSING FINANCE LIMITED) for an amount of Rs. 27,42,074.39 (Rupees Twenty Seven Lakhs Forty Two Thousand Seventy Four and Paise Thirty Nine Only) as on 26.06.2021 and interest thereon.

The Borrowers' attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets.

# DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

MARUTI COMMERCIAL COMPLEX, AUTO POINT COMPLEX, SHOP NO.107. 1ST FLOOR, RAVI TRADERS, NEAR LODHAVAD CHOWK, C.S.WARD NO.7. C.S. NO: 50 & 53-E & A-B-D, OFF.GONDAL ROAD, RAJKOT, GUJARAT - 360002

Date : 06.07.2025 **Authorised Officer** Place: RAJKOT SAMMAAN CAPITAL LIMITED (FORMERLY KNOWN AS INDIABULLS HOUSING FINANCE LIMITED)

## Indian Overseas Bank Gandhi Nagar Branch (0527), Add- 383, Sector -16, Gh Road, Gandhi Nagar, Gujarat-382016 \* E-mail: iob0527@iob.in; \* Website: www.iob.in; Mob. 8925950527 PUBLIC NOTICE FOR E. AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTIES

Sale of immovable property /ies mortgaged to Bank under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (No.54 of 2002) whereas, the Authorized Officer of Indian Overseas Bank has taken possession of the following property/ies pursuant to the notice issued under Section 13(2) of the Security Interest (Enforcement) Rules 2002 in the following loan account with right to sell the same on 'AS IS WHERE IS BASIS' and 'AS IS WHAT IS BASIS' for realization of Bank's dues plus interest & costs as detailed hereunder and whereas consequent upon failure to repay the dues, the undersigned in exercise of power conferred under Section 13(4) of the said Act proposes to realize the Bank's dues by sale of the said property/ies. The sale will be done by the undersigned through e auction platform provided at the Web Portal (https://baanknet.com)

Name & address of the Borrowers: M/s Ved Media Agencies Prop. Mr Sanjay Bhai Goswami (Borrower), Add: 303, Shalin Complex , Sector-22, Gandhi Nagar-382022 Name & address of the Mortgagors/ Guarantors: Mr Sanjay Bhai K Goswami (Mortgagor) Add: 303, Shalin Complex , Sector -22, Gandhi Nagar -382022 & Mrs. Harshaben Sanjay Goswami W/o Sh Sanjay Bhai K Goswami (Guarantor), Add: 239/6 Anand Apartment , Sector

Date of NPA: 26.01.2025, Date of Demand Notice: 05.02.2025, Due Claim in Demand Notice: Rs.15,59,471.06 with up-to-date interest and other legal charges, Date of possession Notice: 20.05.2025. Due Claim in possession Notice : Rs. 16.10,015.00 (Rupees Sixteen Lakhs Ten Thousands and Fifteen Rupees Only) as on 20.05.2025 payable together with further interest at ontractual rates and rests along with costs, charges etc. Outstanding As on 07.07.2025: Rs. 16,40,897.06 (Rupees Sixteen Lakhs Forty Thousand Eight Hundred Ninety Seven and Six Paise only). Other Dues: Not Known [ Local Self Government (Property Tax, Water sewerage, Electricity Bills etc)] **DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY** 

Property details

Known Encumbrance if any

Place: Gandhinagar

Reserve

Rs. 25,000/- to the last higher bid of the bidders

On 28.07.2025 Onwards between 02:00 PM to

Indian Overseas Bank

Types of

Possession

EMD

1	Commercial Shop No. 110, superbult up area admeasuring about 359 Sq Ft. and undivided proportionate share along with common amenities area admeasuring 13.25 Sq Mtrs in the scheme know as "Saundrya 444" land bearing Block No 27/B/1 to 27/B/39 area	24,55,750/- (Rupees Twenty four Lakhs Fifty	Rs.2,45,5 75/- (Rupees Two Lakhs Forty five	Symbolic
	measuring 7560 Aq Mtrs of T.P Scheme No 9 & Final Plot No 57 admeasuring 6048 Sq Mtrs and Block No 29/1, Block 29/7 to 29/11 and Block No 29/169 to 29/62 area admeasuring 15644 Sq Mtrs of T P Scheme No 9 and F P No 58/1 area admeasuring 12512 Sq Mtrs total admeasuring 18560 Sq Mtrs situated at Vasna Hadmatiya,	Thousands Seven Hundred Fifty Only) + Multiplier of	Thousand s Five Hundred Seventy five only)	

Gandhinagar in the nan Keshavgiri Goswami with bo as- <b>Boundaries: East</b> : Fla Kh Road, <b>North</b> : Shop No 1 109	ne of Sanjaybhai (Rupees bundaries hereunder It No B/101, West : Thousands		
Reserve price	Rs. 24,55,750/- (Rupees Twenty four Lakhs Fifty Five Thousands Seven Hundred Fifty Only)		
Date & Time of auction	14.08.2025 between 11:00 A.M. to 01:00 P.M		
EMD	Rs.2,45,575/-(Rupees Two Lakhs Forty five Thousands Five Hundred Seventy five only)		
Auto extension	Auction / bidding will initially be for a period of 12 Minutes with auto extension time of 10 minutes each till the sale is concluded.		
Bid increase amount	Minimum increase in the bid amount must be of Rs. 25 000/- to the last higher hid of the hidders		

Inspection Date & Time 04:00 PM \*Bank's dues have priority over the Statutory dues For terms and conditions Please visit: https://www.iob.in/e-Auctions.aspx https://www.publishtenders.gov.in

Not Known

(https://baanknet.com) (web portal of e-auction of service provider) Date: 10.07.2025 Authorised Officer, B

BAJAJ HOUSING FINANCE LIMITED Corporate Office: Cerebrum It Park B2 Building, 5th Floor, Kalyani Nagar, Pune, Maharashtra 411014, FINSE TV Branch Office 2nd Floor, Office No. 201, Platnum Plaza, Jayshree Rd, above Indian Bank, Kalwa Chowk, Talay Gate, Junagadh, Gujarat 362001 Authorized Officer's Details: Name Pratik Rayal / Email

ld: pratik.raval@bajajhousing.co.in MOB NO. 8980000085 & 9979199099 APPENDIX IV -A [Rule 8(6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY

E-Auction Sale notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of the Security Interest Act 2002 read with provise to rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken over by the Authorized Officer of the Bajaj Housing Finance Ltd (Secured Creditor), will be sold on "As is where is", "As is what is", "Whatever there is and "Without Recourse Basis" for recovery of the loan dues, applicable interest, charges and costs etc., payable to Bajaj Housing Finance Ltd as detailed below

DETAILS OF BORROWER/CO BORROWERS/Guaranter(s)	DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY	DETAILS OF E AUCTION
AND LOAN DETAILS  LAN: H474FLP0342211 &  H474FLP0342416  1. PUSHPENDRASINH RANJITSINH CHUDASAMA (BORROWER) At Takudi Para, Street No.7, Popat Kanano Vistar, Jelpur, Gujorat – 360370 Also At C.s. No. 8328, Sheet No. 77, Takudi Para, Street No.7, Bh. Patel Samaj Off, Takudi Para Road, Nr. Ghelabapa's Clinic, Area: Takudi Para, Jetpur City, Dist.; Rakpt – 360370	immovable property being C.S. No. 8328, Sheet No. 77, Takudipara, Street No. 7, Bih. Patel Samaj Off. Takudi Para Road, Nr. Ghelabapa's Clinic, Area : Takudipara, Jetpur City, Dist. : Rajkot - 360370, Butted & Bounded on East-Land of S. No. 8330 & 8329, West- Other Property North-Adj Public Road & South- Margin	DATE OF INSPECTION: 16/07/2025 to 23/07/2025 BETWEEN 11:00 AM TO 4:00 PM (ST), RESERVE PRICE: For Immovable property Rs. 13,00,000/- (Rupees Thirteen Lakhs Only) THE EARNEST MONEY DEPOSIT WILL BE RS. 1,30,000/- (Rupees One Lakh Thirty Thousand
<ol> <li>RANJITSINH KANUBHA CHUDASMA (</li></ol>	Only) 10% of Reserve Price.	
KANUBHA CHUDASAMA (Col-Borrower)	BID INCREMENT - RS. 25,000/- (Rupees Twenty Fin	
CHUDASAMA (Col-Borrower) All At Takud	Thousand Only) & In Such Multiples.	
Vistar, Jetpur, Gujarat - 360370 Outstandi	Thirty Lakhs Twelve Thousand Seven Hundred Thirty	
Two Only) as on 08/07/2025 along with futu	08/07/2025	

Terms and Conditions of the Public Auction are as under: 1. The Secured asset will not be sold below the Reserve price. 2. The Auction Sale will be online through e-auction portal, 3. The e-Auction will take place through portal https://bankauctions.in, on 29/07/2025 from 11:00 AM to 12:00 PM with unlimited auto extension of 5 minutes each, 4.For detailed terms and conditions please refer company website URL

https://www.balaihousingfinance.in/auction-notices or for any clarification please connect with Authorized officer. DATE: 11-JULY-2025 Place: Junagadh Authorized Officer ( Pratik Raval ) Bajaj Housing Finance Limited

IndiaShelter INDIA SHELTER FINANCE CORPORATION LTD. Regd:Office:- Plot-15,6th Floor, Sec-44, Institutional Area, Gurugram, Haryana 122002, Branch Add. Shop No- 1,2 and 22, 1st Floor, Noble chambers, Near Mega mall-2, Surender Nagar Main road,

Whereas, The Undersigned Being The Authorised Officer Of The India Shelter Finance And Corporation Ltd, Under The Securitisation And Reconstruction Of Financial Assests And Enforcement (security) Interest Act,2002 And In Exercise Of Power Conferred Under Section 13(2)And 13(12)Read With Rule Of The Security Interest (enforcement) Rules,2002,issued A Demand Notice On The Date Noted Against The Account As Mentioned Hereinafter, Calling Upon The Borrower And Also The Owner Of The Property/surety To Repay The Amount Within 60 Days From The Date Of The Said Notice. Whereas The Owner Of The Property And The Other Having Failed To Repay The Amount, Notice Is Hereby Given To The Under Noted Borrowers And The Public In General That The Undersigned Has Taken Possession Of The Property/ies Described Herein Below In Exercise Of The Powers Conferred On Him/her Under Section 13(4) Of The Said Act Read With Rules 8 & 9 Of The Said Rules On The Dates Mentioned Against Each Account. Now, The Borrower In Particular And The Public In General Is Hereby Cautioned Not To Deal With The Property/ies And Any Dealing With The Property/ies Will Be Subject To The Charge Of India Shelter Finance Corporation Ltd For An Amount Mentioned As Below And Interest Thereon, Costs, Etc.

Name of the Borrower/Guarantor (Owner Of The Property) & Loan Account Number	Description Of The Charged/mortgaged Property (All The Part & Parcel Of The Property Consisting Of)	Dt.of Demand Notice, Amount Due As On Date Of Demand Notice	Date Of Possession
MRS.RUPABEN SARADIYA & MR.PREMJIBHAI SARADIYA Resides At: Raysangpar, Sara, Muli Surendranagar, Gujarat-3633010 LOAN ACCOUNT: HL15AHLONS000005073006 & LA15VLLONS000005076595	All Pieces And Parcel Of Open Land Admeasuring 624.38 Sq.Mtrs Bearing Raysangpar Gram Panchayat Akarni Patrak Milkat No. 285 Situated At Gamtal Land Of Village Raysangpar Ta: Muli, Dist: Surendranagar Within The Panchayat Limts Of Raysang Gram Panchayat Muli Surendranagar Gujarat.Bounded With: North: 6.9 Mtrs Wide Road, South: 6.9 Mtrs Wide Road, East: Proj Mtrs Wide Road.	Demand Notice: 11.04.2025 Rs. 13,77,913.30/-(Rupees Thirteen Lakh Seventy Seven Thousands Nine Hun Thirteen And Thirty Paisa Or on 10.4.2025 Together With From 11.04.2025 And Other And Cost Till The Date Of The perty Of Chhanabhai Tejabha	Symbolic Possession dred nly) Due As The Interest Charges ne Payment.

Place: GUJARAT Date: 11.07.2025 For India Shelter Finance Corporation Ltd (Authorized Officer) For Any Query Please Contact Mr. Kishan Chauhan (+91 6354053032) & Mr. Ashish Bhatt (+91 7874110808)

) बैंक ऑफ़ बड़ीदा Bank of Baroda Pal Branch: Shop No. 4 to 7, Royal Platinum, Palanpur Canal Road, Pal, Surat - 395009.

(M): 8980026753, Email: surpal@bankofbaroda.com DEMAND NOTICE (Under Sub-Section (2) of Section 13 of the SARFAESI Act, 2002)

Date: 16.05.2025

To, Mr. Uday Rambrikash Bharti (Borrower) &

Mrs. Rinadevi Uday Bharti (Co-Borrower) Address: Plot No. 157, Vrundavan Park, Village: Tundi, Taluka: Palsana, Gujarat - 394310.

Sub.: Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act,

2002, hereinafter called "The Act" A/c Mr. Uday Rambrikash Bharti (Borrower) & Mrs. Rinadevi Uday Bharti (Co-Borrower). Dear Sir/s, - Ref : Credit facilities with our Bank of Baroda, Pal Branch, Surat We refer to our Letter No. ADV/Retail-00000143466-LMS, Dated: 21.09.2019 conveying sanction of various credit facilities and

the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilising the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under:

Type of Facility	Limit	Rates of Interest	O/s as on 08.05.2025 (inclusive of interest up to 30.04.2025)
Housing Loan	Rs. 10,35,223/-	10.05%	Rs. 7,90,334.23 + unapplied interest thereon + Legal & Other Charges

Security Agreement with brief Description of Securities :- All that Piece and Parcels of the Property of Plot No. 157, Admeasuring 49.18 Square Meters Along with Undivided share in Road and C.O.P of "Vrundavan Park" Plotted in the Non-agricultural Land Admeasuring 25743 Square meters of Revenue Block No. 7/B i.e. Revenue Survey No. 6/A of Village - Tundi, Sub District - Palsana, District - Surat property in the name of Mr. Uday Rambrikash Bharti, Mrs. Rinadevi Uday Bharti. Bounded by :- East : Plot No. 164. West: Society Road, North: Plot No. 158, South: Plot No. 156.

(2). As you are aware, you have committed defaults in payment of interest/Installments on above loans/outstandings for the month on 31.12.2024 and thereafter. (3). Consequent upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 31.03.2025 (mention date of classification as NPA) in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon., (4). Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating Rs. 7,90,334.23 as on 08.05.2025 + unapplied interest thereon + Legal & Other Expenses as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note., (5). Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until paymenat in full., (6). We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section. 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act, (7). We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/inviting quotations/tender/private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available., (8). Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us.

Date: 16.05.2025, Place: Surat Authorised Officer, Bank of Baroda, Surat

Stressed Assets Recovery Branch (SARB) (5181), STATE BANK OF INDIA 4th Floor, Left Wing, Old LHO Building Lal Darwaja, Bhadra, Ahmedabad 380001

# DEMAND NOTICE

A notice is hereby given that the Borrower have defaulted in the repayment of principal and interest of the loans facilities obtained by them from the Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). The notices were issued to Borrower and its Guarantors under Section 13(2) of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 on their last known addresses, but notice issued to the Borrower, one of the

Name of the Borrower(s) of Partner cum Guarantor	Details of Properties/ Address of Secured Assets to be Enforced	Date of Notice	Date of NPA	Amount outstanding (as on the date of notice)
M/s. The Galaxy Travels, (Partnership Firm) 604-605, 6th	All that Non agricultural immovable property having Survey Number 2784,	30.04.2025	22.04.2024	Rs. 2,82,50,896.09,
Floor, SPG Empressa, B/S Passport Seva Kendra. Opp. L G Showroom, Navrangpura Ahmedabad-380009  Mr. Mohommad Sohel Badasaheb Kadri (Partner) R/O B/7 National Flats, Kochrab Kagdivad, Ellisbridge, Ahmedabad - 380001  Mrs. Zohrajabeen Mohommad sohel Kadri (Partner) R/O B/7 National Flats, Kochrab Kagdivad, Ellisbridge, Ahmedabad - 380001  Mrs. Zohrajabeen Mohommad sohel Kadri (Partner) R/O B/7 National Flats, Kochrab Kagdivad , Ellisbridge, Ahmedabad - 380001  Mrs. Lajja Bhavin Parikh (Partner) R/O Samved, Opp Swaminarayan Temple, Opp satellite Tower, B/s Mansi Complex, Satelite, Ahmedabad 380015  Office No. 605 on 6th Floor, admeasuring about 60.76 Carpet area constructed property with undivided share in which is known as "SPG EMPRESSA" on land bearing Ci No. 2784, T.P. Scheme No. 3/3-4 AND F.P.No. 288+289 & No. 9 at lying and bearing at Mouje Shekhpur-Floration of the Floor, admeasuring about 60.76 Carpet area constructed property with undivided share in which is known as "SPG EMPRESSA" on land bearing Ci No. 2784, T.P. Scheme No. 3/3-4 AND F.P.No. 288+289 & No. 9 at lying and bearing at Mouje Shekhpur-Khanpu Sabarmati, District Ahmedabad, Ahmedabad, Number 2784, Unit no. 604 on 6th Floor, admeasuring about 60.76 Carpet area constructed property with undivided share in which is known as "SPG EMPRESSA" on land bearing Ci No. 2784, T.P. Scheme No. 3/3-4 AND F.P.No. 288+289 & No. 9 at lying and bearing at Mouje Shekhpur-Floration of the Floor of the Flo		e in common City Survey 9 & Sub Plot Ipur, Taluka- Issuring Total st Common 90/1 ving Survey about 65 Sq. ed share in and bearing No. 288+289 pur-Khanpur, ad, 380009, led as under Final plot No	Ninety-six & Ps. Nine Only). as on 31.03.2025. with further interest and incidental charges, expenses and penal interest thereon	
Mr. Sandeep Nanu Chaudhary Mrs. Puja Sandeep Chaudhary H/203, Orchid Godrej Garden CityS.G Highway, Jagatpur. Ahmedabad Mr. Sandeep Nanu Chaudhary Mrs. Puja Sandeep Chaudhary J/701, Upvan Flat, Opp.	All that piece and parcel of immoveable Property being FLAT no: J/701, 7th Floor, adm. 57.35 sq mtrs, built up area and mtrs, Total Area 59.93 sq mtrs, in "UPVA Survey no: 332, Final Plot no: 83 in TP CHANDKHEDA, Taluka: Sabarmati, in District: Ahmedabad-2-Vadaj (Mr. Sande	L balcony as N * Scheme, scheme : 69 Registration	in Revenue , of Mouje : District sub	(Rupees Thirty-nine lakh Sixty-six Thousand Four Hundred

thereon The steps are being taken for substituted service of notice. The above Borrower's and Guarantor are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under sub-section (4) of Section 13 of Securitisation and

South: Survey no: 308,331, East: Survey no: 333, 335, West:

Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. The borrowers attention is invited to provisions of Sub-section(8) of Section 13 of the Act, in respect of time available to

Survey no: 329 Tragad Road.

redeem the secured assets. Date: 10.07.2025 Place: Ahmedabad

Near Dhartinagar Bunglow,

Chandkheda, Ahmedabad-

382424

**Authorized Officer** State Bank of India. SARB, Ahmedabad.

only.)

as on 30.04.2025

with further

interest and

incidental

charges,

expenses and

penal interest

B

**BAJAJ HOUSING FINANCE LIMITED** 

Corporate Office: Cerebrum It Park B2 Building, 5th Floor, Kalyani Nagar, Pune, Maharashtra-411014, Branch Office 402, 4th Floor, Aastha Corporate Capital, Vip Road, Bharthana, Surat-395007

Authorized Officer's Details: Name Vishwajeet Tusharkant Singh / email id: vishwajeet.singh1@bajajhousing.co.in MOB NO. 9769688946 & 9033941002 APPENDIX IV -A [Rule 8(6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY

E-Auction Sale notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of the Security Interest Act 2002 read with proviso to rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken over by the Authorized Officer of the Bajaj Housing Finance Ltd (Secured Creditor), will be sold on "As is where is", "As is what is", "Whatever there is" and "Without Recourse Basis" for recovery of the loan dues, applicable interest, charges and costs etc., payable to Bajaj Housing Finance Ltd as detailed below.

DETAILS OF BORROWER/CO BORROWERS/Guarantor(s)	DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY	DETAILS OF E AUCTION		
AND LOAN DETAILS	All That Piece And Parcel Of The	E-AUCTION DATE :-13/08/2025 BETWEEN 11:00 AM		
LAN:- H428HHL1248700 &	Immovable Property Being Flat	TO 12:00 PM WITH UNLIMITED EXTENSION OF 5		
H428HLT1252396	No.202, Second Floor, Building	MINUTES		
1. PRAJAPATI VISHNUBHAI	No.g/2, Bui;ding Type G, Shivpark,	LAST DATE OF SUBMISSION OF EARNEST MONEY		
PARSOTTAMBHAI (Borrower)	Residency, Block No.45 And 47,	DEPOSIT (EMD) WITH KYC IS :- 12/08/2025 UP TO		
2. PRAJAPATI KAMUBEN	Gram Umra, Surat, Gujarat 394105	5:00P.M. (IST.)  DATE OF INSPECTION:- 11/07/2025 to 12/08/2025		
PARSOTTAMBHAI (Co-Borrower) Both At	B 701 Omkar Avenue,	BETWEEN 11:00 AM TO 4:00 PM (IST).		
Amroli Nr Rajwadi Party Plot, Surat, Gujarat	-394107	RESERVE PRICE: For Immovable property Rs. 7,50,000/- (Rupees Seven Lakhs Fifty Thousand		
Outstanding amount - Rs. 13,93,571 /- (Ru	pees Thirteen Lakhs			
Ninety Three Thousand Five Hundred and	Seventy One Only) as	Only)		
on 07/07/2025 along with future interest and	d charges accrued	THE EARNEST MONEY DEPOSIT WILL BE RS.		
w.e.f. 07/07/2025		75,000/- (RUPEES SEVENTY FIVE THOUSAND		
Terms and Conditions of the Public	ONLY) 10% of Reserve Price.			
1. The Secured asset will not be sold	BID INCREMENT – RS. 25,000/- (Rupees Twenty Five Thousand Only) & In Such Multiples.			
2. The Auction Sale will be online thro	Tive Thousand Only) & in Such Multiples.			
3. The e-Auction will take place through portal https://bankauctions.in, on 13/08/2025 from 11:00 AM to 12:00				
PM with unlimited auto extension of 5	minutes each.			

4.For detailed terms and conditions please refer company website URL https://www.bajajhousingfinance.in/auctionnotices or for any clarification please connect with Authorized officer. DATE: 11-JULY-2025 PLACE: SURAT Authorized Officer ( Vishwajeet Tusharkant Singh ) Bajaj Housing Finance Limited

E ALAE

## **BAJAJ FINANCE LIMITED**

REGISTERED OFFICE: Bajaj Auto Limited Complex, Mumbai - Pune Road, Akurdi, Pune - 411035 BRANCH OFFICE: 3rd Floor Unit No 302 To 306 Torquoise Building Opp Centre Point Panchvati Paanch Rasta Off C G Road Ahmedabad 380 006 India Authorized Officer's Details: Name: Abhijeet Singh Jetmal, Email ID: abhijeet.jetmal@bajajfinserv.in Mob No. +91 8619330055.

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)]

e-Auction Sale Notice Under SARFAESI Act 2002 Sale of Immovable Assets Under the Securitization and Reconstruction of Financial Assets and

**Enforcement of Security Interest Act, 2002 ("ACT")** Notice is hereby given to the public in general and to the Borrowers/Co-borrowers/Mortgagor(s) in respect of below mentioned secured asset which is mortgaged with Bajaj Finance Limited ("BFL'), and possession of which had been taken by undersigned Authorised Officer of BFL under the provisions of the ACT will be sold by Auction for recovery of the amount mentioned hereunder and further applicable interest, charges and costs etc...

The secured asset described below is being sold on "AS IS WHERE IS, AS IS WHAT IS AND WHATEVER THERE IS" under Rule No. 8 & 9 of the Security Interest (Enforcement) Rules ("the rules") for recovery of the dues detailed as under:

5
1. N S ENGINEERING PLASTIC (Borrower) At: Barvada, Near Polypack Ck, Sr No 11/2, Navlakhi Road, Rajkot, Gujarat – 363642 2. PRAKASHBHAI PATEL (Co-Borrower) 3. MAMTABEN PATEL (Co-Borrower) 2 & 3 At: Khodiyar Park, Near Aalap Park, Scientific Road, Morbi Gujarat – 363641
4P5E6PLA12351311
Notice dated 20-DEC-2024 Demand amount ₹ 1,36,83,450/-
₹. 1,53,01,993/- (Rupees One Crore fifty three Lakh Fourty One Thousand nine Hundred ninety three Only)
Plot No. 50 admeasuring 234.80 Sq Mtrs bearing Revenue Survey No 122, Paiki 6, and 122 Paiki 7 Green City, Village Ravapara Dis trict. Morbi Gujarat 363641.  East :- 09.00 Meters wide road West :- Plot No. 51 North :- RS No. 126/1 South- 12.00 Meters wide road.
₹ 1,54,36,854/-
₹ 15,43,685/-
13.08.2025 and 03:00 to 05:00
https://bankauctions.in
12.08.2025
₹.50,000/-
Nil
From 13.07.2025 to 11.08.2025 on working day between 9.30 AM to 5 PM with Prior appointment

fails for any reason whatsoever then secured creditor may enforce security interest by way of sale through private treaty, at the discretion on of the secured creditor. For detailed terms and conditions of the sale, please refer to the link https://bankauctions.in and https://www.bajajfinserv.in /auction-notices **BAJAJ FINANCE LTD** Place: Morbi (Gujarat) **Authorized Officer** 

Branch Office: Unit No. G/3, 102-103, Second Floor, C.G.Centre, C.G.Road, Ahmedabad – 380009 Branch Office: 1st Floor, Orbit Tower, Opp Krushi Bazar, Sahara Darwaja, Ring Road, Surat - 395003 Registered & Corporate Office : Yes Bank Limited, Yes Bank House, Off Western Express Highway, Santacruz Fast, Mumbai - 400055 **POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY** 

Whereas, the undersigned being the Authorized Officer of the Yes Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of security Interest Act, 2002 and exercise of powers conferred under Section 13(12), of the Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the Borrowers / Co-Borrowers / Mortgagors mentioned herein below to repay the amount mentioned in the notice, within 60 days from the date of notice / service of the said notice. The Borrowers / Co-Borrowers / Mortgagors having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Co-Borrowers / Mortgagors and the public in general that the undersigned has taken possession of the properties described herein below on in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules. The Borrowers/Co-Borrowers/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with

the properties will be subject to the charge of the Yes Bank Limited for amount mentioned below and interest & expenses thereon until the full payment. This is to bring to your attention that under Sec. 13(8) of SARFAESI Act, where the amount of dues of the secured creditor together with all costs, charges and expenses incurred by secured creditor is tendered to the secured creditor at any time before the date of publication of notice for the public auction/ tender/ private treaty, the secured asset shall not be sold or transferred and no further steps shall be taken for transfer or sale of that secured asset.

NAME OF BORROWERS/

2. Narola Sonalben Saniavbhai (Co-Borrower)

Loan Account No. AFH001101705713

**CO-BORROWERS/ MORTGAGORS/ PROPRIETOR** (1) Soni Maheshbhai Babulal as the (Borrower) & (2) Soni 21.02.2025, Rs. 3022538.53/- (Rupees Thirty Lakh(s) Twenty Two Nimisha Maheshbhai as the (Co-Borrower and Mortgagor) Thousand Five Hundred Thirty Eight And Paise Fifty Three Only) **Loan Account No.** AFH045301923796 as on **21-02-2025** DESCRIPTION OF THE PROPERTY: - All that piece and parcel of the Residential Plot No. 74 to 76/F admeasuring about 64.50 sq. mtr. i.e. 77.14 sq.yard. total construction area 106.62 built up area along with undivided share in Open land & Road & C.O.P. of "JALARAM NAGAR"

situated on the non-agricultural land bearing Revenue Survey No. 179 admeasuring 6-26 Guntha Plot no. 74,75 and 76 total admeasuring 459.26 sq.yard of Moje Village Bhuj Taluka Bhuj District Kutch. and **bounded as under**: East: Plot no. 79, West: 7.50 Mtrs. Internal Road, North: Sub Plot no. (74 to 76) E, South: Plot no. 77. DATE OF POSSESSION: 09.07.2025, TYPE OF POSSESSION: SYMBOLIC POSSESSION 1. Laliibhai Jivabhai Rathod (Borrower & Mortgagor) 2. Devuben

DATE OF DEMAND NOTICE & O/S. DUES

27.01.2025, Rs. 1013429.38/- (Rupees Ten Lakh(s) Thirteen

Laljibhai Rathod (Co-Borrower & Mortgagor) Thousand Four Hundred Twenty Nine And Paise Thirty Eight Only) **Loan Account No.** AFH001100504533 as on **27-01-2025** DESCRIPTION OF THE PROPERTY: - All that piece and parcel of Property bearing Plot no. 611 admeasuring 48 sq. yard i.e. 40.13 sq.mtrs. (admeasuring 40.18 sq.mtrs.) undivided share in the land admeasuring 22.43 in "SHIV VATIKA VIBHAG-2" situated at Revenue Survey no. 70/1 & 70/2 Re-Survey New Block no. 87 & 88 (Old Block no. 66) of Mouje: Nansad Ta: Kamrej, Dist: Surat and bounded as under. East: Society Internal Road, West: Plot no. 588, North: Plot no. 610, South: Plot no. 612.

DATE OF POSSESSION: 08.07.2025, TYPE OF POSSESSION: SYMBOLIC POSSESSION (1) Pramodbhai Tivari as the (Borrower & Mortgagor) & (2) 26.09.2024, Rs. 1153197.99/- (Rupees Eleven Lakh(s) Fifty Three

Annudevi Pramodkumar Tivari as the (Co-Borrower) & (3) | Thousand Two Hundred Ninety Seven And Paise Ninety Nine Only) **Krushnavtar J Tripathi** as the (Guarantor) as on 26-09-2024 **Loan Account No.** AFH001100524670 DESCRIPTION OF THE PROPERTY: - All that piece and parcel of the Plot no. 35 admeasuring 648 sq.ft. i.e. 60.22 sq.mtrs. i.e. 72.02 sq.yard

& Plot no. 36 admeasuring 432.50 sq.ft. 40.19 sq.mtrs. and 48.06 sq.yard. in "HASTI VILLA" situated at Block no. 341/B/Paiki-1 total admeasuring 01 Hector 37 Are 59 sq.mtrs. i.e. 13759 sq.mtrs. Of Moje Village: Mulad Ta. Olpad Dist: Surat. and bounded as under: East: Society Road, West: Building No. G/3, North: Building No. G/1, South: Society Road. DATE OF POSSESSION: 09.07.2025, TYPE OF POSSESSION: SYMBOLIC POSSESSION 1. Sanjay Hardasbhai Narola (Borrower & Mortgagor), 27.01.2025, Rs. 1363876.54/- (Rupees Thirteen Lakh(s) Sixty

Three Thousand Eight Hundred Seventy Six And Paise Fifty Four Loan Account No. AFH001100299045 Only) as on 27-01-2025 DESCRIPTION OF THE PROPERTY: - All that piece and parcel of Property bearing Flat No. 303 on the 3rd Floor, admeasuring 717 sq. feet, i.e., 66.61 sq. meters, Super Built-up area, Along with an undivided share in the land of "Param Residency, Building No. D," Situated at Block No. 102/A, 1 to 5 (Plot No. A1 to 5), admeasuring 1301 sq. meters, of Moje Village Laskana, Ta: Kamrej, Dist: Surat and bounded as under:

East: Block No. 104, West: Flat no. D-304, North: Flat no. D-301, South: Block No. 102. DATE OF POSSESSION: 08.07.2025, TYPE OF POSSESSION: SYMBOLIC POSSESSION 1. Sanjaykumar Balakram Sakya (Borrower & Mortgagor), 30.01.2025, Rs. 1603576.2/- (Rupees Sixteen Lakh(s) Three 2. Anujkumar Balakram Shakya (Co-Borrower & Mortgagor) Thousand Five Hundred Seventy Six And Paise Twenty Only)

as on 30-01-2025 **DESCRIPTION OF THE PROPERTY:** All that piece & parcels in the land bearing Plot No. 216 (After K.J.P. Block No. 289/B/130/216) admeasuring about 67.22 sq. mts. along with undivided proportionate share in land for Road and COP admeasuring about 35.89 Square Meter.known as "PRATISHTHA PARK VIBHAG-1" situated Revenue Survey no. 193, 194, 195/1+2, Paiki, 201, 207/2 & 214/2 given New Block no. 289 admeasuring 61616 & Revenue Survey no. 195/1 + 2 Paiki, 196 & 200 given New Block no. 291 admeasuring 31363, on the land bearing Block No. 289 & 291 after Dusari divide Block no. 289/A, 289/B & 291/A, 291/B of Village Mulad Taluka Olpad District Surat.

and bounded as under, East: Plot No. 215, West: Plot No. 217, North: Plot No. 199, South: Road. DATE OF POSSESSION: 09.07.2025, TYPE OF POSSESSION: SYMBOLIC POSSESSION 1. Somaram Savjibhai Chaudhary as the (Borrower & Mortgagor) 21.02.2025, Rs. 1444063.24/- (Rupees Fourteen Lakh(s) Forty Four & 2. Keu Devi Somaram as the (Co-Borrower & Mortgagor) Thousand Sixty Three And Paise Twenty Four Only)

**Loan Account No.** AFH001100678432 as on 21-02-2025 DESCRIPTION OF THE PROPERTY: - All that piece and parcel of the Residential Plot No: 64 (As per KJP Block no. 309/64) admeasuring about 42.41 Square Meter, along with an undivided proportionate share in the said land for Road and COP of the society known as "Chandradarshan Residency-1" situated bearing Revenue Survey No: 326, Block No: 309 admeasuring 26281 sq.mtrs. of Village: Kamrej, Taluka: Kamrej, District: Surat. and bounded as under: East: Plot no. 63, West: Plot no. 65, North: Plot no. 89, South: Society Road.

DATE OF POSSESSION: 08.07.2025, TYPE OF POSSESSION: SYMBOLIC POSSESSION 1. Suraj Sitaram Yadav as the "Borrower & Mortgagor" & 2. 13.02.2025, Rs. 1428462.97/- (Rupees Fourteen Lakh(s) Twenty Durgavatidevi Sitaram Yadav as the "Co-Borrower & Mortgagor" Eight Thousand Four Hundred Sixty Two And Paise Ninety Seven Loan Account No. AFH001101841022 Only) as on 13-02-2025

DESCRIPTION OF THE PROPERTY: All that piece and parcel of the land bearing Plot No. 48 admeasuring 70.76 sg. mtrs [as per KJP revenue record 302/A/48 admeasuring 70.76 sq. mtrs] together with common rights in road and COP at "Kavya Residency" situated on the

land bearing Revenue Survey No. 232/1, 232/2, 233/1, 233/2, 234/1, and 234/2 its Block No. 302/A admeasuring 39457 sg. mtrs paiki admeasuring 30,330 sq. mtrs of Village-Mulad, Taluka-Olpad, Registration District Surat. and bounded as under: East: Plot No. 47, West: Plot No. 49, North: Society road, South: Plot No. 35. DATE OF POSSESSION: 09.07.2025, TYPE OF POSSESSION: SYMBOLIC POSSESSION

(1) Vasava Sureshbhai Shanubhai as the (Borrower & Mortgagor) 25.11.2024, Rs. 1635675.66/- (Rupees Sixteen Lakh(s) Thirty Five (2) Vasava Darshanaben Sureshbhai as the (Co-Borrower & | Thousand Six Hundred Seventy Five And Paise Sixty Six Only)

Mortgagor) & (3) Rajubhai Amarasinh Vasava as the (Guarantor) as on 25-11-2024 Loan Account No. AFH001101567704 **DESCRIPTION OF THE PROPERTY:** All That Piece And Parcel of Plot no. 74 J type admeasuring about 42.41 sq.mtrs. Along with

Undivided proportionate share in the land for Road and COP admeasuring about 34.65 sg.mtrs. of the Society Known as "RADHE RESIDENCY-2" situated bearing Revenue Survey no. 285/1, 2 Paiki 287/1+2, Block no. 417 and 418 (after consolidation New Block No. 417) admeasuring 8296 sq.mtrs. of Village: Mulad, Taluka: Olpad, District: Surat. and bounded as under: East: Society Road, West: Plot no. 69, North: Plot no. 75, South: Plot no. 73. DATE OF POSSESSION: 09.07.2025, TYPE OF POSSESSION: SYMBOLIC POSSESSION

27.01.2025, Rs. 1357784.51/- (Rupees Thirteen Lakh(s) Fifty 2. Jayshriben Vipulbhai Paghadal (Co-Borrower & Mortgagor) Seven Thousand Seven Hundred Eighty Four And Paise Fifty One **Loan Account No.** AFH001100311888 Only) as on 27-01-2025 DESCRIPTION OF THE PROPERTY: - All that piece and parcel of Property bearing Plot No: 8 (Plot no. 53/8 as per KGP) of which the area of plot admeasuring to 72.48 Sq. Mts. (77.58 Sq. Mts. as per records of 7/12) of the society known as Aangan Residency, Constituting of the N.A. land bearing, Revenue Survey No. 53, Block No. 53 situated Moje Village: Koli Bharthana in Sub-District & Taluka: Kamrej District:

Surat. and bounded as under: East: Plot no. 09, West: Plot no. 07, North: Society Road, South: Society Boundries. DATE OF POSSESSION: 08.07.2025, TYPE OF POSSESSION: SYMBOLIC POSSESSION Date: 08.07.2025, 09.07.2025 Sd/- Authorised Officer,

Ahmedabad

Yes Bank Limited

epaper.financialexpress.com

Place: Ahmedabad & Surat

1. Vipulbhai Kanjibhai Paghadal (Borrower & Mortgagor),

અમદાવાદ, શુક્રવાર, તા. ૧૧ જૂલાઈ, ૨૦૨૫ ફાયનાન્સિયલ એક્સપ્રેસ

### ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ આકર્ય કોર્યાસ સ્ટાર્ય પ્રાપ્ત કરાય કોર્યિલ્સ લાઇલ્સ્ટ્રેસ પાર્ક સામાનાના હવા પ્રાર્થ

ટાટા કાપટલ લાકાનગ સુંચાળાજન લાનાટક સ્ટાસ્ટર્ડ ઓફીસ : ૧૫મો માત, ટ્રાયર મે, પ્રીજનાવા ળિઝનેસ પાર્ક, ગણપત્સવ દરમ માર્ગ, હોઝર પાર્રેસ, પૃંતા - ૧૦૦૦ હોઝર પાર્રેસ, પ્રોથી માત, કેપિટલ બાર્જિકોરો, પ્રોથી ડીફ્સી હોઇ પ્રત્યે એકોએફમો લેંક વસ્ત્રે, મીઠળ બાર્ય્યપુરા, અમદાવાદ, યુપ્સત - ૧૦૦૦લ.

1 (2002) 155.4 ક્રી. ક્રીમાની 155.4 કર્યા કર્યા કરતા કરતા કરતા કરતા કરતા કરતા કરતા કરત
વારાવુ વૃકા) કુલ રૂ. રફદરવવા - (ફાવરા

sines (Proceding Control of Cont

II "'	10 teteli. adj. alim : ga. 500 vi. 3-410, alian: els, cite. vii. 610, cite. 500 vi. 3-400						
5	TCHHL069 1000100115 089.8	શ્રી રાજેશ મંગલગર	રૂા. ૩,૯૪,૭૧૩/– (રૂપિયાત્રણ લાખ ચોરાલું હજાર સાતસો તેર પુરા)	<b>રૂા. ૬,૦૦,૦૦૦/–</b> (રૂપિસા છ લાખ પુરા)	રૂા.રૂા. ૭૪૫૩૭/– (રૂપિયા ચુંમોતે૨ ૯૧૧૨ પાંચસો સાડગ્રીસ પુરા)		
	TCHIN0691 0001001171	ગોસ્વામી	એગ્રીમેન્ટ નં. TCHHL0691000100115069 હેઠળ તમારા દારા બાકી અને ચકવવા પાત્ર	અનેંસ્ટ મની	એગ્રીમેન્ટ નં. TCHIN0691000100117141 હેઠળ તમારા દારા બાકી અને		
	41	શ્રીમતી મુકતાબેન	અને <b>રૂા. ૫૨,૦૧૯</b> /- (રૂપિયા બાવન ફજાર ઓગણીસ પુરા) એગ્રીમેન્ટ નં.	31. 80,000/-	ચુકવવા પાત્ર અને ૫૩૨૦૯૭/- (રૂ પિયા પાંચ લાખ બત્રીસ ઠજાર		
		રાજેશગર ગોસ્લામી	TCHIN0691000100117141 &sot	(રૂપિયા સાઠીઠ ઠજાર પુરા)	સત્તાણું પુરા) એગ્રીમેન્ટ નં. – હેઠળ		
			તમારા દ્વારા બાકી અને ચુકવવા પાત્ર, કુલ રૂા. ૪,૪૬,૬૩૨/- (રૂપિયા ચાર	-	તમારા દ્વારા બાકી અને ચુકવવા પાત્ર		
			લાંખ છેતાલીસ હજાર સાતસો બગ્રીસ પુરા)	મકાર કબજાનો	કુલ રૂા.૬૦૬૬૩૪/– (રૂપિયા છ લાખ છહુજાર છસો ચોગીસ પુરા)		
			2 92 202X	ભૌતિક	0x 00 202U		

સ્થાવર મિલકતોની વિગત: પ્લોટ નં. ૪૬, ક્ષેત્ર45ળ ૮૮,૦૦ ચો.મી. ખૂલો પ્લોટ (પ્લોટ નં. ૪૬ નો પ્લોટ નં. ૧), રેવન્થુ સર્વે નં પ્ર૧૦)ષ ના કુલ ૬-૧૨ ગૂંટાની સ્વેટીક્સીયલ હેતુસરની બિલન એતીલાંધક જમીનના પ્લોટના, મોર્જેન્સાંગદ, પેટા ઉત્તરો-અંજર, ઉત્તરો-ક્લઝ, ગુભવા ખાતીને સ્થાવર મિલનાને તામમ ભાગ અને હિસ્સા. સતુ:સીમા : પુર્વ: અંદરનો રોડ, પશ્ચિમ :પ્લોટ નં.૨૦, ૩.૦૫ મીટર પછી સેરી, ઉત્તર:પ્લોટ નં.૪૦, ઢલાય: પ્લોટ નં. ૪૫

		. 0102-11 210, 414	11 -410 -1100, 510 1 -1100 401 411	.,	Ciqicii -tiio -ti o i
3	TCHHL062	શ્રી હિતેષકુમાર	રૂા. ૯૮,૦૪૧/– (રૂપિયા અકાણું હજાર	₹1. ₹0,40,000/-	રૂા. ૨૬૯૫૬૬૨/– (રૂપિસા છવ્લીસ
	800010017	પંચાભાઈ	એક્તાલીસ પુરા) એગ્રીમેન્ટ નં.	(રૂપિયા વીસ લાખ	લાખ પંચારાું હજાર છસો બાસઠ
	6839 &	દેસાઈ	TCHIN0628000100178776 èson	પરશાસ હજાર પુરા)	પુરા) એગ્રીમેન્ટ નં. TCHH.0628000100176839
	TCHIN0628		તમારા દારા બાકી અને ચકવવા પાત્ર	અનેંસ્ટ મની	હેઠળ તમારા દારા બાકી અને
	000100178	શ્રીમતી ભાવનાબેન	અને 31, ૨૨,૯૪,૦૪૨/- (ઉપિયા	31. 2,04,000/-	ચકવવા પાત્ર અને રૂ. ૧૨૧૬૮૬/-
	776	હિતેષકુમાર	બાવીસ લાખ ચોરાણં હજાર બેતાલીસ	(રૂપિયા બે લાખ પાંચ	(રૂપિયા એક લાખ એકવીસ હજાર
		રબારી	પરા) એગ્રીમેન્ટ નં.	હત્મર પુરા)	છસો છ્યાંસી પુરા) એગ્રીમેન્ટ નં.
			TCHHL0628000100176839 &644		TCHIN0628000100178776 ઢેકળ તમારા દારા બાકી અને
			અને કુલ રૂા. ૨૩,૯૨,૦૮૩/– (રૂપિયા	હળજાનો	राधायमध्य हारा जाडा अन
					કુલ રૂા. સ્ટ૧૭૩૪૮/– (રૂપિયા
			ત્રેવીસ લાખ બાણું હજાર ત્થાંસી પુરા)	SIGK	સુલ ફા. સ્ટલ્ઇક્કટ)- (ફાવલા અઠયાવીસ લાખ સત્તર હજાર
				ભૌતિક	ત્રણસો અડતાલીસ પરા )
			49.00.2028		08.06.9084

100.000 પ્રાપ્ત કરવાના કરવ સ્થાવર મિલકતોની વિગત: પહોર નં. ૧૦, કોપકુર ૧૬૪ હતા તે. તી, નીચેતી જમીનમાં ન લહેલાકોલ હિસ્સો અને આંદર અને બહારના વારવાની વિકલ વિગત ત્રીકે જાણીલ ક્રિયામાંત્રીએ ક્રમ્યામાં, રેઆવું સર્વને ન સ્થાપીકી અને રેસીએન્સીયલ હેતુસરની બિન-એનીલાલ વારવી ગામ માતરવાડી સીમ એટલે કે હરિસ્ટ મહાદ માદિર કેઇ નો દિશ્યલ લસ્ક્ર પાલવ- કિસ્સ કેડની પૂર્વ, સ્ટ્રાપ્ટેશન કિસ્ટ્રેક્ટ પાલક, પ્રિંગ ત્રીને ત્રાલકો પ્રાપ્ત કરવાના મોતી સ્થાર વિસ્તા કરવાના કરતા કરવાના કરતા કરવાના કરતા કરતા કરતા કરતા કરતા કરતા ક

	અં	દરનો રોડ, દક્ષિ	પણ: પ્લોટ નં. ૧૧		, ,	
	×	TCHHL027 400010018 4490 & TCHIN0274	પિસુષભાઈ વિનુભાઈ મકવાશા	રૂ. ૧૪,૩૪,૬૬૮/– (રૂપિયા સૌદ લાખ યોત્રીસ હજાર છસો અક્સઠ પુરા) એગ્રીમેન્ટ નં. TCHH.0274000100184490 હેઠળ	રૂા. ૧૪,૬૫,૦૦૦/- (રૂપિયા ચૌદ લાખ પાંસઠ ઇજાર પુરા)	રૂ. ૧૬૪૦૩૦૦/– (રૂપિસા સોળ લાખ સાલીસ હજાર ત્રણસો પુરા) એગ્રીમેન્ટ નં. TCHHL027400100184490
		000100186 498 & TCHIN0274 000100279 972	કૃતિકાબેન પિયુપભાઈ મકવાણા	ાતમારા દ્વારા બાકી અને ચુક્લવા પાત્ર તમારા દ્વારા બાકી અને ચુકલવા પાત્ર અને ફ્રા. ૧,૧૨,૪૧૧ - (શ્રીધ્યાએક લાખ બારાઠ ઠજાર રાતરારો એક્તાલીસ પુષા) એગ્રીમેન્ટ ન TCHIN0274000100279972 હેકળ તમારા દ્વારા બાકી અને	અર્જેસ્ટ મળી જ્ઞા. ૧,૪૬,૫૦૦/– (રૂપિયા એક લાખ છેત્તાલીસ હજાર પાંચસો પુરા)	ેંદેકળ તમારા દ્વારા ભાકી અને ચુક્રવા પાત્ર અને શુ. ૧૮૭૫૩૫/– (રૂપિયા એક લાખ સિત્ચાંસી હજાર પાંચથો પાત્રીસ પુરા) એગ્રીમેન્ટ ને. TCHIN0274000100279972 હેઠળ તમારા દ્વારા ભાકી અને
1-				શુક્લવા પાત્ર શ. ૬૩,૦૦૦/- (શ્રીયા ત્રેસદ હત્યક સિરાદે પુશ્ન ) એગોમેન્ટ તં. TCHING274000100186498 હેઠળ તમારક ફાર બાકી અને શુક્લવા પાત્ર, કુલ શ. ૧૬,૬૦,૪૦૯/- (શ્રીયા સોળ લાખ સાલીઠ લાગ્ય સારસો ઓગલખેતી પુત્ર)	કબજાનો પ્રકાર ભૌતિક	યુકવાના પાત્ર અને રૂપિયા જન્મનો '(રૂપિયા યુંગોતે ર જન્મર નવસો એકાવું પુત્ર) એનીમેન્ટ ને TCHN027400100188498 હેઠળ તમારા દ્વારા બાકી અને યુંકવાનાપાત્ર યુંલ શુ. ૧૯૨૭૩૧૬/ (રૂપિયા ઓગોલીશ લાખ બે હન્મ સાતસો છત્રીસ પુરા) ૭૪.૭૪.૨૦૨૫
- 1	સ્થાવર મિલકતોની વિગત: કલેટ નં. ૩૦૫. ત્રીજો માળ. ટાવર બી. બિલ્ટ અપ એરિયા ૪૬૫.૦૦ થો.ક્ટ. તેમજ પરમ ગીન્સ તરીકે				. તેમજ પરમ ગ્રીન્સ તરીકે જાણીતી	

. www.cc. રાગલ જા. આ-30ર પણ પરાજે સ્તરામુક્તાં જારેફ રાજવાનો વ્યક્તિગત રીતે તેમની બીંડ(ડી) જ્યા કરવા આમેજા છે. આ વેચાણ સાથે સંકળાવેલ કોર્પણ કરજ નિભાવતા અદિકારી જ્યાંચ અન્ય ત્યક્તિ શીધી કે આક્તની રીતે બીંડ કરવા અથવા સ્થાવર મિલકતોમાં કોર્પણ દીત મેળવવા અથવા મેળવવાનો પ્રચાસ કરી શકશે નહી.

રાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

### ઇન્ટ્રેસ સેપિટલ લીમીટેડ

हानु, कोड़ीका कर, मेहण किरदीन, प्रक. नहें हो बीद , स्वी हिंदि ने पहल्कर हुए . कोड़ीका कर, मेहण किरदीन, प्रक. नहें हो बीद , स्वी हिंदि , स्वी हिंदि । पहल्कर हुए . कोड़ीका कर मेहण किरदीन हुए . कोड़ीका कर निकार हुए . कोड़ीका कर नहें किरदूर हुए . कोड़ीका कर . कोड़ीका क

ત્રા પુત્ર-પાત્રાહાલા પ્રાપ્ત ભા દવાના ભાગ છે. ક્યાં સાર્ટ પુત્રેગ મિલકત બી વિગત ક્યાં સાર્ટ પુત્રેગ મિલકત બી વિગત બતો ક તે, ૧૦૫૧ (ગુનો સર્વે નં.કફ્ટ/૧) અને બ્લોક નં ૧૦૫૩, ખાતા નં.ક૫૩, મોજે રેશાલ, તાલુકો સાર્શદ, પેટા બિલો સાર્થાદ, અમદાલાદ, ગુજરાત ખાતેની સ્ત્રીકેન્લીસલ/કોમસિયલ મિલકત જોન[બિલ્ડિકો/ગુટક્સ અને કીક્સનેલ તમામ ભાગ અને દિસ્સા. સાણંદ, પેટા જિતાં સાણંદ, અમદા જમીન/બિલ્ડીંગ/સ્ટ્રક્ચર અને કીક તારીખ: ૦૭.૦૭.૨૦૨૫ સ્થળ: નહેરુ પેલેસ, નવી દિલ્હી અધિકૃત અધિકારી ઇન્ટેક કેપિટલ લીમીટેક

### વેલસ્પન સ્પેશિયાલિટી સોલ્યુશન લીમીટેડ

CIN 1.27 1906.11980PL.C020205 १९९४-६५ भोजी सः प्रोट नं. १, १९७१ माडी सं एक्ट्रियत केस्टेट, व्यारिका शेट, क्रोमेंट्ट व्यक्तिसः प्रोच्छेन माडी स्थान क्रिक्ट, क्रामा क्रिक्ट क्रामा क्रिक्ट क्रेमेंट्ट व्यक्तिसः प्रोच्छेन माडा क्रेस्टिट (विट्ट), मुंब्यान क्रामा क्रिक्ट क्रेस्टानी व्यक्तिसः प्रोच्छेन माडा क्रिक्ट क्रिक्ट क्रामा क्राम क्रामा क्राम क्रामा क्राम क्राम क्राम क्राम क्राम क्राम क्राम क्र

## ફોન : +લ-૨૨-૬(૧૩૬૦૦૦ ફેક્સ : +લ-૨૨-૨૨૦૦ ૮૦૦૦ વેલ્સ્પન સ્પેશીચાલીટી સોલ્યુશન્સ લીમીટેડના કીઝીક્લ શેર્સની દુાન્સફર અરજીઓ ફરીચી દાખલ કરવાની ખાસ વિન્ડો

તેબી પરિપત્ર નાં. SEBI/HO/MIRSD/MIRSD-PoDIP/CIR/2025'97 તારીખ ૨ ગુલાઈ, ૨૦૨૫ ત્રન્વયે, કંપનીના તમામ શેરહોલ્ડરોને આથી જાણ કરવામાં આવે છે કે ફીઝીકલ શેર્સની ટ્રાન્સકર અરછુઓ, જેવ એપ્રિલ, ૨૦૧૯ની ડેડલાઇન પહેલા દાખલ કરાઇ હતી ને દરતાવેજો/પ્રક્રિયા/અથવ અન્ય ખામીને લીધે રદ/પરત કરાઇ હતી અથવા ધ્યાને લેવાઇ ન હતી તે ફરી દાખલ કરવા માટે જન્ન પામાને લીધે કર્યું પાસ્ત કરાયો હતો સમાના આત્મ લેલામાં ન હતી તે કરી દાયલ કરવામાં સ્થાપ લિલ્ડો ન બુલી તે કરી દાયલ કરવામાં કહ્યું હોય કર્યું હોય કરી દાયલ આપ્તા મેડું જો છે. કેસાલાલને કેલા લાગે કરી હોય કરી દાયલ છે. તેઓ હાં બારે કર્યું હોય કરી દાયલ છે. તેઓ હાં બારે કર્યું હોય કરી દાયલ છે. તેઓ હાં તે સ્થાપ હોય કરી હોય કરી હોય કરી હોય કરી હાં હોય કરી હોય કર

તારીખ: ૧૦ જુલાઈ, ૨૦૨૫ રથળ : મુંબઇ

## ઇન્ડસઇન્ડ બેંક લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફીસ : ૨૪૦૧, જેળ. શિમ્માશા શેડ, (કેન્ટોનમેન્ટ), પુને– ૪૧૧ ૦૦૧ :જ્ઝ્યુમર ફાચનાન્સ કિવિઝન : ન્યુ નં. ૩૪, જી.એન. ચેફી સેડ, ટી. નગર, ચેજ્ઞા–૬૦૦ ૦૧ સજ્ય અથવા શાખા ઓફીસ : ઇન્ડસઇન્ડ બેંક, ૩જો માળ, બિઝનેશ એમ્પાયર–૫, ૧/૫

### કબજા નોટીસ

(Heard Bild ઇન્ટરેસ્ટ (એન્ટ્રોનેસ) (Heard ) દાવારા ના નિવાર (૧) હેઠા) આવી. (Heard Bild ઇન્ટરેસ્ટ (એન્ટ્રોનેસ) (Heard), 2004 ના નિવાસ (૧) હેઠા) આવી. એનલે ઇન્ટરાઇન એક લીધીટલન નીતે અહી કન્યર આદિકૃત સ્વીધારીએ લિક્સોડીઆઇનલ અન્દ કન્યર્ટાકન અહીં 3 કારનાનિવાસ એર્ટ્સિટન ના તેને કન્યોર્સન પ્રવાસીટલોન કિર્માર હોય, અરુપ (તર્મ આ પ્રીસ્ત નાર્કીટ લાંગ્રી છેટ્ટી અર અને લિક્સોડીની ઇન્ટરેસ્ટ (એન્ટ્રોનેસ)-ફન્સિટન (સર્વાર) હતા (સર્વાર) વિસ્તાર વર્લીટ લાંગ્રી છે) ના નિવાર લાંગ્રી નાર્કી છતા ૧૩ (૧) દેવા માત્રી તલાની છતારે છોએક) કરીને નીત્રે માત્રો હાલ્યોડ ખેલાની કર્યા ત્રી કર્યા હોય પ્રવાસી ત્રીને માત્રો તાર્કી નાર્કી તાર્કી ત્રાની માત્રો સ્વાન નાર્કી ત્રાની કર્યા લાંગ્રી સ્વાન માત્રી ત્રાની લાંગ્રી સ્વાન નાર્કે સ્વાન નાર્કિસ્ટ નાર્કિસ માત્રી સ્વાન મોત્રી સ્વાન નાર્કિસ્ટ નાર્કિસ માત્રી સ્વાન મોત્રી સ્વાન નાર્કિસ્ટ નાર્કિસ્ટ નાર્કિસ્ટ નાર્કિસ્ટ માત્રી સ્વાન મોત્રી સ્વાન નાર્કિસ્ટ માત્રી સ્વાન મોત્રી સ્વાન નાર્કિસ્ટ નાર્કિસ્ટ નાર્કિસ્ટ નાર્કિસ્ટ માત્રી સ્વાન મોત્રી સ્વાન નાર્કિસ્ટ નાર

8위 여.	દેવાદાર/જમીનદારનું નામ / લોન એગ્રીમેન્ટ નંબર	માંગણા નોટીસની તારીખ કબજાની તારીબ	બાકી રકમ
1.	દેવાદાર : શ્રી અમીતભાઇ મનસુખભાઇ અગાવત શહુ-દેવાદાર : શ્રીમતી અગાવત અલ્લાબેન અમીતભાઇ જે અમીતભાઇના પાસી લોન એગ્રીમેન્ટ નંબર : GRR05251M લાકીખ ૧૯.૦૨.૨૦૨૦ લાકીખ ૧૯.૦૨,૨૦૨૦	30.09.२०२५ 8.09कती तारील 06-00-२०२५	રૂા. ૧૧૧૬૪૧૪.૮૬/- (રૂપિયા અગિયાર લાખ સોળ હજાર ચારસો ચૌદ અને છમાંશી પૈસા પુરા) ૩૦.૦૧.૨૦૨૫ મુજબ તેના પરને શક્ત બ્યાજ

મ/૧૮ ૨૦૫ – સાઇડ એન્ડ સર્વિસ, ગુવરાત હાઉસિંગ બોર્ડની

૧૬૧, ગામ-કાઠારિયા, ૧૧૧૧–૨૧૧૬૧૮ ખાતના રાસડન્સાયલ મિલકત. <b>થતુઃસામા</b> : પુત : જાહેર રોડ, પશ્ચિમ : યુનિટ નં. ૩૧, ઉત્તર : યુનિટ નં. ૧૭, દક્ષિણ : યુનિટ ૧૯				
તારીખ : ૦૯.૦૭.૨૦૨૫ સ્થળ : રાજકોટ	ઇન્ડસઇન્ડ બેંક લીમીટેડ વતી સદી/– (અધિકૃત અધિકારી)			

PhoenixARC (IN: U67190	નિશ્વ : ગ્રીજો માળા, બોલેસ ટાવરાં ૧૩૯ ાલે પારલે (ઇસ્ટ) મુંબઇ–૪૦૦ વપક હૈ MH2007PTC168303 <b>ઇમેઇલ</b> : ir	રસી પ્રાઇવેટ લીમીટેડ (૧૪૦/બી/૧, કોર્સીંગ એક્ લઢર અને વેસ્ટર્ન એક્સપ્રેસ ઠા લી ૧૦૨૦-૧૮૩૬ ૨૪૫૦, કેક્સ ૧૦૨૦-ડ્રેઝલ ૨૩૧૩ (૧૦૦૦) દાનોજનાદ ૮૦.૩૧, વેબસાઇટ :www.phoenicarc ઈ સાથે વંચાતા સિક્સોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રકરાન ઓફ	<sub>xx.in</sub> <b>નોટીસ</b>	લોન નં. LXNAR00415-160021781 શાખા : નાશેલ દેવાદાર : કીપિકહુમાર ભરતકુમાર શિંદે, સદ-દેવાદાર : પ્રીતી કીપિકહુમાર શિંદે	ર૪-૦૬-૨૦૧૯ રૂ૧.૮,૦૬,૬૭૮ (રૂપિયા આઠ લાખ છોતેર છરસો ઇંદ્રચોતેર પુરા
ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ <u>ટેકળ</u> આવી ખાસ કરીને દેવાદારો/જામીનદારો/ગીરટે એસ્પાયર હોમ ફાયન્શન્સ કોર્પોરેજન લીમીટેક ત (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ અન્	સ્થાવર મિલકત(તો) ના વેચાણ માટે દારો અને ૧૧ઢેટ ૧નતાને આથી નોટ રીકે ૧૧ણીતી –એસાર્થનર ) દ્વારા એસા ૧૯ સાથે વંચાતી સર કૈસી એક્ટની ૧૧		મોસવાલ ક્ષેમ કાચળાવ્ય લીમીટેડ (અગાઉ ને ગીરો કરાચેલ છે, જેસિક્યોરીટી ઇન્ટરેસ્ટ મજ સડત વ્યાજ, સાર્વિસ અને ખર્સ વગેરેની	લોન નં. LXNAR00416-170642279 શાખા: નાસેલ કામ્પ્રા: નાસેલ કામ્પ્રા: સેલ્પલ્લાફુર બીમળલ્લાકુર યુન, સ્કલ્–દેલાદાર : બિંદુ પ્રેમળત્લાકુર યુન	ર૩-૧૨-૨૦૨૦ રૂ૧. ૩,૪૬,૮૩૫ (રૂપિયા સાત લાબ છેલાલી આઠસો પંચોતેર પુર
	સમય: તારીખ: ૧૯-૦૮-૨૦૨૫ સવારે દેઠ ૫ મિનિટના અમર્ચાદિત લંબાણ ર		ડી જ્યા કરાવવાની છેલી તારીખ : ૧૮–૦૮–૨૦૨૫	લોન નં. LXNAR00216-170037564 શાખા : નાશેલ	\$6-08-2096 \$1.4,80,000
દેવાદાસ(સે)/ધામીનદાસ(સે)/ લોન એકાઉન્ટ	માં ગણા લોદીસલી તારીબ અને ૨૭૧	રવાલર મિલકતની લિગત	રીઝર્વ ઉંગત, ઇએમડી	દેવાદાર : રાજુભાઇ માગજીભાઇ ગોહિલ, સહ–દેવાદાર : પારાલબેન રાજુભાઇ ગોહિલ	(રૂપિસા પાંસ લાખ ઓગદ હજાર નવસો નેવું યુ
લોન નં.LXKAD00217-180055762 શાખા : કરોદરા દેવાદાર : સત્યેન્દ્રકુમાર શિવાનંદન હુશવાઢ, સહ-દેવાદાર : લલિતા દેવી સત્યેન્દ્રકુમાર કુશવાહ	૨૬-૦૩-૨૦૧૯ રૂ૧. ૭,૮૧,૩૯૬ (રૂપિયા સાત લાખ એક્સાસી હત્તર ત્રણસો છતું પુરા)	પ્લોટ નાં. ૩૧૯, ગ્રીન એલન્લુ, રેવન્યુ સર્વે નં. ૨૫૦/બી, ઉદિરક્ષ ગામ, અંકલેશ્વર, ભરૂથ-૩૯૩૦૦૧, ગુજરાત	ર દિઝર્લ કિંમત : રા. ૩,૦૦,૦૦૦ (રૂપિયા ત્રણ લાળ પુરા) ઇએમડી : રૂા. ૩૦,૦૦૦ (રૂપિયા ત્રીસ હન્તર પુરા)	લોન નં. LXPAL00416-170050299 શાખા : પાલનપુર દેવાદાર : છાતેન્દ્રસિંહ વગેસિંહ ડાન્મી, રાહ—દેવાદાર : કાંશુખા છાતેન્દ્રસિંહ ડાન્મી	૨૮-૦૨-૨૦૧૦ રૂગ. ૪,૩૮,૪૩૬ (રૂપિયા ચાર લાખ આડત્રી સારસો છત્રીસ પુરા
ભોન નં. LXSUR00215-160009416 શાખા : સુરત દેવાદાર : નિતિન વિજય સાલી, સહ–દેવાદાર : લતાબેન નિતિન સાલી	૧૬-૦૩-૨૦૨૩ રૂા. ૧૫,૪૮,૧૮૯ (રૂપિશા પંદર લાખ અન્દનાલીસ હજાર એક્સો નેવ્યાસી પુરા)	ક્લેટ નં. છુ-૧ અને છુ-૨, સુકન રેસ્ટિન્સીન્ન, સોની પા લાઉસિંગ સોસ્થાટી-૨, ભ્લોક નં. ૨૪૫૧૧-એ ૧૨૧૩-એ ૧૪૧ ૧૬, ભ્લોક નં. ૩૮ અન્સે ૪૪ ૪૪૩ ૧૫૬૩૩૩-એ૩૧૬, પી. ૩૦ ૪૦૮, ૨૦૦ અને ૧૯૫૦ (લ્લ્ડ આ પ્લેશિસ ૨૯૮, ૧૬ લો.મી.). ૭, ૧ અને ભિલ્હ અપ એસ્થિા ૧૭૮,૪૦ અને ૨૫.૮૬ લો.મી., મોર્ગ	4 (રૂપિયા એક લાખ પાંસક હજર પુરા) . ઇએમડી : રૂા. ૧૬,૫૦૦ ૫ (રૂપિયા સોળ હજાર પાંચસો પુરા)	તોન નં. LXBOT00416-170038879 શાળા : બોરાદ દેવાદાર : રશાઇોડભાઇ ભુરાભાઇ ડાંગર, સહ-દેવાદાર : જ્યુબેન રશાઇડબાઇ ડાંગર, જામીનદાર : મેઘાભાઇ વજેકરણભાઇ સાતિયા	૧૦-૧૨-૨૦૨૦ રૂા. દુ,૦૫,૯૫૨ (રૂપિયા છ લાખ પાંચ હનાર બાલન પુરા)
લોલ નં. LXADA00418-170039050 શાખા : અડાવશ દેવાદાર : જીતેન્દ્રનાથ સમયવતાર રાય, સલ-દેવાદાર : થમતા જીતેન્દ્ર રાથ	૨૮-૦૧-૨૦૨૧ ફા. ૧૩,૫૫,૮૫૮ (રૂપિયા તેર લાખ પંચાલન હજાર સાતસો અદ્ભાવન પૂસ)	તાંતીલૈયા, તાલુકો-પલસાશા, વિદ્યો-સુરત, ગુજરાત-૩૯૪૩૯ ફલોટ નં. બી/૪૦૧ અને બી/૪૦૨, બ્લોક નં. /૧૧૫,પ્લોટ નં. દૃ. ૬૮, ૬૯, ૩૦, શ્રી રાધા રમણ રેવિડેન્લી, લક્ષ્મીનારાચ સોસાચઢી, કેનાલ સેડ, કડોદરા, પલસાશા, સુરત-૩૯૪૩૨, ગુજરાત	, રિઝર્વ કિંમત : રૂા. ૨,૩૦,૦૦૦ (રૂપિસા બે લાખ ત્રીસ ઢળાર પુરા)	સોન નં. LXBOT00217-180054231 શાખા : બોટાદ દેવાદાર : વિપુલભાઇ લાલજીભાઇ ગોહિલ, સત—દેવાદાર : મીનાબેન વિપુલભાઇ ગોહિલ	૧૯-૧૨-૨૦૧૯ રૂ૧. ૪,૩૭,૦૫૨ (રૂપિયા સાર લાખ સાક્ઝી નવસો બાવન પુસ
લોલ નં. LXSUR00318-170045609 શાખા : સુરતર દેવાદાર : કેલાસ સમલાલ જાઢ, સહ–દેવાદાર : ગીતા કેલાસ જાઢ	૧૦-૧૨-૧૦૨૦ ૧૧.૧૯,૭૮,૫૬૮ (રૂપિયા ઓગણીસ લાખ ઇઠ્યોતેર લેજાર પાંચલી અફ્સઠ પુરા)	પ્લોટનં. ૧૩૦ (કે પાસિંગપ્લોટ મુકામ-પ્લોટનં. 19/૧૩૦), સુરા રેલિકેલ્લી, રેવળ્યુ સર્વે નં. ૭૬ અને ૭૭, બ્લોક નં. ૫૭ (ટિઝ પાસિંગુનો બ્લોક નં. ૭૩/લી), શ્રી રિફિટ્ડ રેલિકેન્સી પાકળા, ગણે બંગલીઝ પાસે, મનકદાદ, મોરલાદાદ શેડ, કામકેળ, શોર્લાસ સુરત, ગુજરાત-૩૯૫૦૦૯	ો રિઝર્લ કિંમત : રૂા. ૧૧,૦૦,૦૦૦ ર્ડ (રૂપિયા અગીયાર લાખ પુરા) દ ઇએમકી : રૂા. ૧,૧૦,૦૦૦	. લોખ નં. LXBOT00217-180065240 શાખા : ભોટત દેવાદાર : દિલીપભાઇ ભગવાનભાઇ કંઝારીઓ, સત્ય-દેવાદાર : ચંદ્રિશનોબ્ન દિલીપભાઇ ઝંગરીઓ, જામીનદાર : દ્વિતેપભાઇ મધ્યોલાલભાઇ કંઝારીઓ,	૧૩-૧૦-૨૦૨૨ રૂા. ૪,૨૯,૦૪૯ (રૂપિયા ચાર લાખ ઓગા હજાર ઓગશપરમાસ
લોન નં. LXSUR00216-170046352 શાળા : સુરત દેવાદાર : સુરેશનુમાર જ્યારંકર ગોડ, સત્-દેવાદાર : દૂલકુમારી સુરેશ ગોડ	૧૦-૦૦-૧૦૨૧ ફા. ૬,૨૫,૧૦૯ ( રૂપિયા છ લાખ પરથીસ હજાર એકલો ઓગાદસઍલી પુરા)	ક્તોટ નં. એ-જ૧, વ્રજકોમ્પલેસ, સર્થિન રેલ્વે સ્ટેલન રોડ પાર છોટુકાકાળી વાડી, પાલીગામ, સર્શિળ, સુરત, ગુજરાત–૩૯૪૩૨	9 (રૂપિશા એક લાખ પાંસઠ હજાર પુશ) ઇએમડી : રૂા. ૧૬,૫૦૦ (રૂપિશા સોળ હજાર પાંચસો પુસ)	લોના નં. LXRA.100217-180061270 શાખા: રાજકોટ દેવાદાર: જનાદિધાનાઇ કાનજીનાઇ લોળકિયા, સહ—દેવાદાર: મંગુબેના કાનજીનાઇ લોળકિયા, જમીનાઇટ: ગાપીશ નાનજીનાઇ ચાવકા	१४-०८-२०२१ इ. ४,२६,६६६ (इपिया सात व्यान कोञ इन्तर छस्सो छत्ने पुर
લોન નં. LXBAR00316-170037978 શાખા : વડોદરા દેવાકાર : ભરત શિમનલાલ પંચાલ, સત્તુ-દેવાકાર : અંજનાબેન ભરતભાઇ પંચાલ	૧૩-૧૦-૨૦૨૨ ફા. ૨૨,૪૪,૦૯૨ (રૂપિયા બાલીસ લાખ યુગ્માલીસ હજાર નવ્લાણું પુરા)	કૂલ્લેશ નં. ૨૦, બ્લોક નં. ૧૯૫, રેલન્યુ કર્લો નં. ૧૬૨(ર, સે રેસિકેન્સી, કોમફલ્ડ પ્લોટ કોરિયા ૩૩૬ લો. ફુટ અને વમીનન ન વહેંત્સોલા પ્લોટ અને જમીના, કોરિસા ૫૩૫,૨૦ સો. ફુટ, બિ. અમ એરિયા ૧૫૧૦ લો. ફુટ, આસોદર લાર ૨૨૯૧, મોજે-ગ્રમ અસોદર, પેટા જિયો. અને તાલુકો-અંકલાવ, જિયો-આલંદ ૩૮૮૦૦૧, ગુજરાત	(રૂપિસા બાર લાખ દસ હજાર પુરા) ઇએમડી : રૂા. ૧,૨૧,૦૦૦	લોન નં. LXSUR00316-170025861 શાખા : સુરત દેવાદાર : રાધે રસામ દેઉધસાદ પ્રગથતી, સહ–દેવાદાર : દેખાદેવી સદીરસામ પ્રગથતી	૨૩-૧૨-૨૦૨૦ રૂા. ૫,૦૩,૩૫૫ (રૂપિયા પાંચ લાખ તોલેર ત્રણસો પંચાવન પુર
લોન નં. LXAHM00315-160013722 શાખા : અમદાવાદ દેવાદાર : વિશાલભાઇ મનુભાઇ વ્હેરક, સહ-દેવાદાર : પુનમ વિશાલભાઇ વ્હેરા	ર૮-૦૫-૨૦૧૮ ફા. ૨૨,૦૩,૦૧૩ (રૂપિયા બાવીસ લાખ તોત્તેર હતાર નવસો તેર પુરા)	શ્રીજી ફ્લોસ, ભાગ-બી-૧૨૮ અને ૧૨૯, ઠનુમાંનજી મંદિર પારે અમદાવાદશ્રી સંબ્કોટ ઠાઇવે, સર્વે નં. ૧૧૯, દાનરસામપૂ સિંબડી, હનુમાનજી મંદિર-૩૮૨૩૫૦, અમદાવાદ, ગુજરા	. (રૂપિયા પાંચ લાખ પરશાસ હબાર પુરા)	૧. હરાજી બીડ દરતાવેજની અન્ય શરતો અ શિક્સોર્ડ એસેટની વિગતો અને ઓનલા https://www.auctionbazaar.con	ઈન ૧મા કરવાના બીડ
હોન ને. LXHIM00416-170024176 શાળા : હિમ્મતનગર દેવાદાર : નારાશણભાઇ પ્રભુભાઇ પટેલ, સહ-દેવાદાર : પ્રમાનંદહુમાર નારાચણભાઇ પટેલ	૦૪-૦૫-૨૦૧૯ રૂા. ૧૧,૩૫,૦૩૬ (રૂપિસા અગીસાર લાખ પાંત્રીસ હવાર નવસો છોતેર પુરા)	મિલકત ને, ૪૦, સર્વે ને. પ્લોટ નં. ગામતળ, મુકામ–વડગામ પીઓ શ્રેસ્સણા તાલુકો–વડાલી, સાંબરકાંઠા–૩૮૩૨૩૫ ગુજરાત	. (રૂપિયા આઠ લાખ એંસી હજાર પુશ) ઇએમડી : રૂા. ૮૮,૦૦૦ (રૂપિયા ઇલ્યાસી હજાર પુરા)	દિપક ઠાકુર – ૮૯૦૬૭૬૬૩૧૦, શૈલેય આવે – ૭૭૦૭૧૦૭૩૦૬, ચાવડા વિશાલ – ૧૩૭૨૭ – ૯૪૧૭૨૬૧૩૮૨ નો સંપર્ક કરી શકે છે. contact@auctionbazaar.com નો સં	<b>૧૦૪૩૯૫, રાજીલ હિતેન્દ્રક્</b> વિગતો ઉપરોક્ત વેબપો iપર્ક કરી શકે છે.
લોન નં. LXKAD00117-180055916 શાખા : કડી દેવાદાર : મહમંદવસિમ મહમંદહુસૈન વ્હોરા, સલ–દેવાદાર : યુનુસ મહમંદહુસૈન વ્હોરા,	૦૯-૧૧-૨૦૨૨ ફા. ૧૦,૧૮,૯૦૩ (રૂપિયા દસ લાખ સત્તર હજાર બવસો ત્રણ પુશ)	ક્લોટ નં. ૧૧, બીજો માળ, સંવત્તી એપાર્ટમેન્ટ, સિટી સર્વે ન ૧૧૨૭/પૈકી, પેચ, મુકામ–મિલકત નં. ૮૬૫, મોલે–પેચાયુ તાલુકો–ગાંદી!લગર, વિશો–ગાંદી!લગર, ગુવરાત-૩૮૨૬૧	. (રૂપિસા પાંસ લાખ પરસાસ હજાર પુરા)	ર. તમામ ઇચ્છુક ખરીદારો/બીડરોએ ઉપર જણાવેલ પોર્ટલ https: હરાજીમાં ભાગ લેવા માટે વિના મુલ્યે ચુઝર આઇડી અને પાસવર્ડ મે 3. ઈ–હરાજીમાં ભાગ લેવા માટે ઇચ્છુક બીડરો/ખરીદારોએ સિક્ચોર્ડ કંપનીના હિસ્સામાં બોર્ડ રીઝોલ્યુલન તેમજ સરનામાના પુરાશ ઉપર \$. હરાજીના કોઈપણ સ્તરે અધિકતરી અધિકારી કોઈપણ આગોતરી ન	
હોન નં. LXAHM00417-180065603 શાખા : અમદાવાદ દેવાદાર : ભીખાભાઇ રમેરાભાઇ મીલા, સત–દેવાદાર : વિનોદ રમેરાભાઇ મિલા	૦૧-૧૦-૨૦૨૦ રૂ૧. ૧૨,૧૮,૬૦૮ (રૂપિસા બાર લાખ અઢાર હજાર છસ્સ્થે અહાર્યું પુરા)	ક્લેટ નાં. બી/પાજ, પાંચમો માતા, સર્વે નાં. ૫૦૨/૨, ટીપી સ્કીબ ૨, દાનલક્ષ્મી રેલિકેળ્સી, મોજે-નાંદેજ, અમદાવાદ, ગુજરાત ૩૮૨૪૩૫		મુલતવી/રદ કરી શકે છે. ૫. સફળ ખરીદાર/બીડરે લાગુ કાયદા અ ચુકવવાપાત્ર ફી, ખરીદ કિંમત પર લાગુ છુટ ૬. ઇચ્છુક બીડરોએ તેની બીડ જમા કરતાં	મેસટી, સ્ટેમ્પ ડ્યુટી, રજી પહેલા બોજાઓ, હરાજી પ
कोल नं.LXAHM00217-180063100 शाणा: अमहावाह हैतावा : अमहावाह	\$1. c,42,562	ફલેટ નં. હદ, પહેલો માળ, બ્લોક-દ, કામદોનું સેપાર્ટમેન લાસન કલબ ઓફ નશેડા સામે, ગુઆઇડીસી શેડ, નશેડ મામદાવાદ મામ્યાન-૧૯૭૩		કાનુની બાકી વગેરે અંગે તેમની રીતે સ્વતં? આવશે નહી. ફોનિક્સના અધિકૃત અધિક હ. ભાવી (ઇજાન બીડગેએ સોગંધનામં આ	તરી કોઇપણ ત્રાહીત વ્યક્તિ

3	લોળ નં. LXNAR00415-160021781	₹8-0 <b>६-</b> ₹0 <b>9</b> €	ફ્લેટ લં. બી-૪૦૩, સોથો માળ, બ્લોક લં. બી, ઘલલફમી	રિઝર્વ કિંમત : રૂા. ૩,૩૦,૦૦૦
5	શાખા : નાશેલ	\$1.0,05,500	રેસિડેન્સી, સર્વે નં. ૫૦૨/૨, ટીપી સ્કીમ નં. ૨, એડીસી બેંક પાસે,	(રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર પુસ)
	દેવાદાર : કૌધિકહુમાર ભરતકુમાર સિંદે,	(રૂપિયા આઠ લાખ છોત્તેર દુજાર	નાંદેજ, અમદાવાદ, ગુજરાત-૩૮૨૪૩૫	ઈએમડી : રૂા. 33,000
સંમેન્ટ	સલ-દેવાદાર : પ્રૌતી કીધિક કુમાર સિંદે	છસ્સો ઈફ્યોતેર પુરા)		(રૂપિયા તેત્રીસ હજાર પુરા)
समन्द	siles et. LXNAR00416-170042279	23-12-2020	એ-૭૦૧, સાતમો માળ, પ્રાપ્તાત રેસિડેન્સી, બલેક લં. એ, રેવન્ય	રિઝર્લ કિંમત : રૂા. <i>હ</i> ્વય,૦૦૦
	શાળા : નાગેલ	31,0,88,684	સર્વે નં.૧૪૨૩,એક.પી. નં.૩૩૬,ટીપી રહી મનં.૧૨૮,ન્ય વટવા	(રૂપિસા સાત લાખ પંદર હજાર પૂરા)
આગાઉ	દેવાદાર :પ્રેમબઢાદુર ભીમબઢાદુર પૂળ,	(રૂપિયા સાત લાખ છેતાલીસ હબાર	શી એસ.પી. રિંગ રોડ, શક્તિ ઢાઉસ પાછળ, ન્યુ વટવા,	ઇએમકી : ગ્રા. ઠવ,૫૦૦
35559	સલ-દેવાદાર : બિંદુ પ્રેમબહાદુર પૂન	આઠસો પંચોતેર પુરા)	SHEIGHE, PINSIG-3600SE	(રૂપિયા ઈક્કોતેર હુજાર પાંચસો પુરા)
ાગેરેની		onoth value 3th)	-	(prairozate ant antil 30)
ભાવસે.	siles et. LXNAR00216-170037564	9.0-0X-909.6	સી/૪૧૮, ચોચો માળ, શહિત એવન્યુ, સરખેવ બાવળા ઠાઇવે,	રિઝર્વ કિંમત : રા. ર.,ર૦,૦૦૦
	211M : a13k4	31. 4.20.000	સાક્ષ્યટ, ચાંચા માળ, લાકત અવલ્યુ, સરબંગ બાવળા દાઇવ, મોરૈયા એપ્રોસ રોડ. અમદાવાદ–૩૮૨૨૧૩, ગંજરાત	(રૂપિશા ત્રણ લાખ ત્રીસ હુંબર પુરા)
	દેવાદાર : રાજુભાઇ પ્રાગભાઇ ગોહિલ,		HIERI OIRIN ELS, OINEIGIC-SCEETS, JUEIN	
	સહ-દેવાદાર : પારાલબેન રાજભાઇ ગોહિલ	(રૂપિસા પાંસ લાખ ઓગણપરસાસ		ઈએમડી : રૂા. 33,000
	the deficient action of grand amount	હજાર નવસો નેવું પુરા)		(રૂપિયા તેત્રીસ હજાર પુરા)
•	લોન નં. LXPAL00416-170050299	86-66-6646	મિલકત લં. ૧૫૨, ધોરી સીમ, તાલુકો-ઘડગામ, જિલો-	રિઝર્વ કિંમત : રૂા. ૧,૧૦,૦૦૦
	શાળા : પાલનપુર	३।.४,३८,४३६	બનાસકાંઠા-૩૮૫૧૨૦, બનાસકાંઠા, ગુજરાત	(રૂપિયા એક લાખ દસ દજાર પુરા)
	દેવાદાર : જીતેન્દ્રસિંહ વયેસિંહ ડાભી,	(રૂપિયા ચાર લાખ આડગ્રીસ હજાર		ઇએમડી : રૂા. ૧૧,૦૦૦
	સલ-દેવાદાર : કાંચુબા જીતેન્દ્રસિંહ કાભી	ચારસો છત્રીસ પુરા)		(રૂપિયા અગીયાર હજાર પુરા)
	લોન નં. LXBOT00416-170036879	90-92-2020	પ્લોટ નં. ૪૭, રામદેવ નગર, રેવન્થ સર્વે નં. ૪૫૫/૬, પાછા છેઠની	રિઝર્વ કિંમત : રા. ૨,૭૫,૦૦૦
۰	શાખા : બોટાદ	31. 5,04,040	વાડી પાસે, આઇટીઆઇ કોલેજ સામે, ધાંણકીયા રોડ, મોજે-	(રૂપિશા બે લાખ પંશોતેર હુજાર પૂરા)
પુરા)	દેવાદાર : સ્ટાઇડિબાઇ ભૂસભાઇ ડાંગર,	(રૂપિયા છ લાખ પાંચ હજાર નવસો	બોટાદ, ભાવનગર, ગુજરાત-૩૬૪૭૧૦	ઇએમડી : રા. ૨૭,૫૦૦
.	સહ-દેવાદાર : જ્યુબેન રણછોડભાઇ ડાંગર,	બાલન પુરા)	-	(રૂપિયા સતાલીસ હબર પાંચસો પુરા)
(18)	જામીનદાર : મેઘાભાઇ વજેકરણભાઇ સાતિયા	307		(4
- 1	siler ei. LXBOT00217-180054231	96-95-5096	પ્લોટ નં. ૫૧, સર્વે નં. દદ૦, બાળર પરા, ન્ય બસ સ્ટેશન પાછળ.	રિઝર્વ કિંમત : રા. ૫,૫૦,૦૦૦
•	શાળા : બોટાદ	31. 8.30.048	21251, 21981d-35884o	(રૂપિયા પાંચ લાખ પરશાસ હજાર પુરા)
(1S)	દેવાદાર : વિપુલભાઇ લાવભુભાઇ ગોહિલ,	(રૂપિયા ચાર લાખ સાકગીસ ઢજાર		ઇએમડી : રા. ૫૫,૦૦૦
·	સદ-દેવાદાર : મીનાબેલ વિપુલભાઇ ગોહિલ	નવસો બાવન પુરા)		(રૂપિયા પંચાવન હવાર પુરા)
			વસવાપસ, મિલકતનો સિટી સર્વે નં. સફદ, જમીન ૩૦૨-૧૦	
	લોના નં. LXBOT00217-180065240	43-40-6066	વસવાપસ, મિલકતનો સિટી સવે ન. સુષ્ઠા, જમીન ૩૦૨-૧૯ ચો.મી., સેન્ટ્રલ ભાજ જમીન ૮૨-૦૦ ચો.મી., મકામ-લિંબડી.	રિઝર્વ કિંમત : રૂા. ૫,૫૦,૦૦૦
0	રાખા : બાદાદ દેવાદાર : દિલીપભાઇ ભગવાનભાઇ કંઝારીયા.	31.8,26,086	ચા.મા., સન્દ્રલ ભાજુ જમાન ૮૨-૦૦ ચા.મા., મુકામ–ાલબડા, ભોજનગાળા પાસે. તાલકો–લિંબડી, જિલો–સરેન્દ્રનગર–	(રૂપિયા પાંચ લાખ પચ્ચારા ઢળાર પુરા)
"	સત્-દેવાદાર : સંદ્રિકાબેન દિલીપભાઇ	(રૂપિયા ચાર લાખ ઓગણત્રીસ	3E3X89,31981d	ઇએમડી : રૂા. ૫૫,૦૦૦
ger)	કંઝારીયા,	હજાર ઓગણપરમાસ પુરા)	againet, great	(રૂપિસા પંચાવન હજાર પુરા)
3	જામીનદાર : હિતેપભાઇ મણીલાલભાઇ કંગારીમા			
	લોન નં. LXRAJ00217-180061270	42-00-5064	પ્લોટ નં. ૦૩ પૈકી, ઘર્મસિહિ સોસાયટી, સીયાસમ વીટ્રીફાઇડ	દિઝર્વ કિંમત : રૂા. ૩,૮૫,૦૦૦
પુરા)	annı: stasis	31.0,26,565	પાસે, (જુના જાંબુડિયા પાસે), ટર્ઝ નેશનલ હ્યાવેટ, મોરબી,	(રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર પુરા)
	દેવાદાર : જ્યદિપભાઇ કાનજીભાઇ ઘોળકિયા, સહ-દેવાદાર : મંગુબેન કાનજીભાઇ ઘોળકિયા,	(રૂપિયા સાત લાન ઓગશત્રીસ	รเพราะ, วุเพรเส-353588	ઈએમડી : રૂા. ૩૮,૫૦૦
(a)	જામીનદાર : ભાવેશ નાનજીભાઇ શાળકા,	હત્મર છસ્સો છક્ષું પુસ)		(રૂપિયા આડત્રીસ હજાર પાંચસો પુરા)
·	_			
(15I)	લોન નં. LXSUR00316-170025851	63-66-6060	પ્લોટ નં. ૩૪૧, ગ્રીન એવન્યુ, ઉટિસાદ્રા, ગોડુલઘામ રેસિડેન્સી	છિકવે કિંમત : રૂા. ૩,૦૦,૦૦૦
	શાળા : સુરત	રૂા. ૫,૦૩,૩૫૫	પાસે, રેવન્યુ સર્વે નં. ૨૫૦-બી, અંકલેશર, ભરૂચ, ગુજરાત-	(રૂપિયા ત્રણ લાખ પુરા)
ME	દેવાદાર : રાધે શ્યામ દેકીપ્રસાદ પ્રજાપતી, સહ–દેવાદાર : રેખાદેવી સઘેશ્યામ પ્રજાપતી	(રૂપિયા પાંચ લાખ તોતેર હજાર	36-5004	ઈએમડી : રૂા. ૩૦,૦૦૦
	લલ–દવાદાર : રખાદવા રાશ્વરસામ પ્રજાપતી	ત્રણસો પંચાવન પુરા)		(રૂપિયા ત્રીસ હજાર પુરા)
•		1		
2 Y21)	. હરાજુ બીડ દરતાવેજની અન્ય શરતો અને નિયમો અને તેમાં જણાવેલ પ્રક્રિયા અનુસાર હાથ ધરવામાં આવશે. બીડરો બીડીંગ માહીતી– સહાય, ઇ-હરાજી માટે મકાર			
	સિક્સોર્ડ એસેટની વિગતો અને ઓનલાઇન જ્યા કરવાના બીડ કોર્મ માટે. અમારા ઇ-ઠરણા સર્વિસ પ્રદાલ <b>મેસર્સ આઇ ઇમાર્ડ. પ્રાઇવેટ લીમીટેડ</b> ના વેબ પોટ			

ોક કુંબે માટે, અભારા ઇ-કરાયુ રાર્વિસ પાકાના સેમને આઇ તેમાંદ્ર, માર્વિસ રીમીટેકના વેલ પોર્ટ કે દે દાવાલું અદીદારો આ પાપેટલ પર હરાયુંની શરતો અને લિયામાં આમ પ્રક્રિયાના અનુરારી લોકો છે અને પ્રતિયાલ સિંદ તમારા ૧૦૯૦૦૨૧૧૦, સરીચા વિસ્ત્રાસિક હાર્દેવસિક - ૧૫૩૩૨૧૫૧, મહેના માર્ન પ્રસ્તુપાર પાયાલ - ૯૬,૦૦૯૧૫૧૬, હેમલ ભરતભાષ દલાવી - ૯૯૯૦૩૦૩૩, ભારક દોતનાસિક્ટલપાર્ટીસિક પાર્ટિલ પ્રિપ્ટ (ભારત છે અને તેમના સેન્ડ્રિયાઇ) કહેલ પેક - ૧૯ 4,૩૦૦૬ (દર્શક, પ્રીપાર આઇટે

w.auctionbazaar.com/ ઉપર તેના નામ રજીસ્ટર કરાવીને ઉપરોક્ત તારીખ અને સમગ્રે ઇ

//www.aucifonhazaac.com/ પિસ્ટ તેના નામ સ્કુસ્ટર કરવીને પિચ્ટોક્ત તારીખ અને સમગ્રે ઇ-લાઈ લો વા ખરતી ! - મિલકાના રીખર્દ કિમાના ૧૦ ટર કી ઇટ્ટિંગ્લા અનેટ માર્ગ પિડામીટલી ચુકવાણે વિઝાતો તેમપાચાનાઇટ - સ્પામાર્તા કોએને પ્રમુખ કરવાની શ્રીતા લીખ સાથે પ્રચાર એ પ્રદેશ બન્ન કરવાના સ્ટેન્સ અને કરવાના સ્ટેન્સ ત્રોમાં કોઈ સ્ટામિક્સ અને કોઇપણ કારણ પણાવ્યા વગર બીડ/ઓફરનો સ્થીક્સ/અરબીક્સ રહ્યા અથવા હસ્સ